



NU-21004

Seat No. \_\_\_\_\_

**Third Year B. A. (Non CBCS) Examination**

February – 2017

**Economics : Paper - 6**

(Micro Economics) (New Course)

Time : 3 Hours]

[Total Marks : 100

- સૂચના : (૧) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તર આપો.  
(૨) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.  
(૩) જરૂર જણાય ત્યાં આકૃતિ સાથે જવાબ લખો.

૧ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સમજાવી તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વર્ણવો. ૨૦

અથવા

૧ તટસ્થ રેખાનો અર્થ સમજાવી તટસ્થ રેખા દ્વારા ગ્રાહકની સમતુલા સમજાવો. ૨૦

૨ ટૂંકાગાળામાં પૂર્ણ હરીફાઈ હેઠળ પેટ્ટી અને ઉદ્યોગની સમતુલા સમજાવો. ૨૦

અથવા

૨ ટેકનિક અવેજના સીમાંત દરનો નિયમ સમજાવો. ૨૦

૩ બિન પ્રમાણસરનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. તે પેટ્ટીને કઈ રીતે ઉપયોગી છે ? ૨૦

અથવા

૩ (અ) આવક અસરનો ખ્યાલ સમજાવો. ૧૦

(બ) મૂડીરોકાણ વિશ્લેષણની પે-બેક પદ્ધતિ સમજાવો. ૧૦

૪ અલ્પહસ્તક ઈજારો એટલે શું ? અલ્પહસ્તક ઈજારામાં ખાંચાવાળી માંગ રેખા સમજાવો. ૨૦

અથવા

૪ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો સમજાવો. ૨૦

૫ ટૂંક નોંધ લખો : (કોઈ પણ બે) ૨૦

- (૧) પેઢીનો વિસ્તરણ માર્ગ
- (૨) શૂન્ય આધારિત બજેટ પદ્ધતિ
- (૩) ઈજારાયુક્ત હરીફાઈનાં લક્ષણો
- (૪) સમ ઉત્પાદન વક્ર.

## ENGLISH VERSION

- Instructions :** (1) Answer all questions on the basis of internal option.  
(2) All questions carry equal marks.  
(3) Write answer with diagram when necessary.

1 Explain the meaning of Micro Economics and describe its nature and scope. 20

OR

1 Explain the meaning of indifference curve and explain the consumer's equilibrium. 20

2 Examine the short run equilibrium of firm and industry under perfect competition. 20

OR

2 Explain the law of marginal rate of technical substitution. 20

3 Explain law of non-proportional output by of diagram and explain how it is useful for a firm ? 20

OR

- 3 (a) Explain the concept of income effect. 10  
(b) Explain the pay-back method of investment analysis. 10

4 What is oligopoly ? Explain the Kinked demand curve in oligopoly? **20**

**OR**

4 Explain the types of elasticity of demand. **20**

5 Write short notes : (any two) **20**

(1) Firm's expansion path

(2) Zero based budgeting

(3) Characteristics of monopolistic competition

(4) Iso product curve.